

रंगीसी होगी.



श्रीश्री वाच्यन्तराग्नो.

स्थागान्नारानेमाटे.

छपावनार.

र-ना
~~~~~

(0/0)

यस्यैवैसी सुहृद्वीनी सागस्यैवैसी

स्यस्यैवैसी सुहृद्वीनी सागस्यैवैसी

मन. शोभतं स्यस्यैवैसी



दि. सु. ल. ली. म. ज. यो. ड. मा. ग. र. ड. ड. ड. ड.

यस्यैवैसी सुहृद्वीनी सागस्यैवैसी

होगी नली

हुंनलं नमं मे ४ ४४-२सीली दंगमा रोला

मे सु नमं नमं मन्व्यो ४४. ४४.

मेरी होरी मन्व्यो, नगत मामी द्वे यतराई

मेरी होरी मन्व्यो ॥ १ ॥

प्योनी सेरीमां नानी गवरी तें पुष्प पुंम म

थाई, राय नमो धामां मंनछी दीवाली तुं पु

परगे दोषाई नगत सति द्वेरीय साई, मे

यी हांरी न्याई नमं नगतमामी ॥

रगनाथधरामां नही रन पु ताएरी, ओ

पुठी पुंनदेडे न्यारी;

मोटा सेरीमां छासयाली, तारी पेदेडी न

लेछामारी तारे त दा न्याये न्यायन

मेरी नीरी ॥ ३ ॥

रनदनाने नगीरी नगीरी नें नु नु नु नु

આઈ, મંચર પરામાં રહે છે નીચેથી તે ખુબ  
ધુબ-અહરી નાગા થવીથી વ્યાપ વીચાઈ;

એરી હોરી મચાઈ ॥ ૪ ॥

કનસારા જેમાં મોલીએ જરની તું છે બ  
ડી દગાવાળી નણ આંશ નો એક આલો ક  
ગથવો, ભડવા રહે છે આં-આં, તારી સુ  
ખી રહે છે ન્યારી ॥ રે રે રે રે ॥ ૫ ॥

ન દા ખાઈમાં નાહાની ન મની, બંગડી  
નો ભપકો છે તારી, કેરીરીઆ રંગ ગોળી  
કરીને ગોળી મચાવી છે તારી - દીવળી તા  
હોનો ભપકો છે તારી ॥ એરી હો ॥ ૬ ॥

હુરી પરામાં રહે છે કનસારી, ભપકો રા  
ખે છે તારી, પાન ખાઈ પીચકારી માને છે,  
રાત ઘંવસ ખેરી વ્યાની. ર ધિ વ્યું ઘા

તારી ॥ એરી હોરી ॥ ૭ ॥

શાન ખાલાને મળેલ રહે છે, ફોફની નમ  
 ની વ્યુષ્યારી, શાધે સુનાનો સુરો પેફેરી  
 ને ભયજો રાષે વાગો ભારી, ભેઈને હું થઈ  
 છે છે સાંધારી ॥ એની ॥ ૮ ॥

ફરી પરામાં મંજ ડીબ વાગુ, દેવલીનો  
 ભયજો છે ભારી, માફાલી તારી પુષ્પી નંગ  
 તન્નારો સુ છે વાગી ~~માગી તારી~~ સગલ  
 ગત પ્યારી ~~ફેઈને ફેઈરી~~ ॥ ૯ ॥

પીઠારે સામું મહુલોને દવ નમણ ॥ ૧૦ ॥  
 રી ફુને તી થઈ રાંરી; ~~દેવજી~~ ગી  
 રજી ખતરે ~~ફુફરી~~ પાલીજો ~~વપજો~~ તે ભા  
 ડી ~~પાં~~ ~~જારી~~ ~~વગી~~ ~~વાજારી~~ ॥ એ ~~વજા~~

ફોટ ઠીયર વલી રેફે છે રે ફમલી, રી વજે  
 રની પેફેરી છે ભારી, વલી તાજી સત ફની  
 છે ખલાવે ગા, ~~વલી~~ ~~ની~~ ~~પી~~ ~~રે~~ ~~વ~~ ~~વી~~

ही नो अमत्रो छे त्तारी ॥ अरेरी छेरी ॥ ११ ॥

गंधरु द्रुली आमां रे, सुवन आमाणी,

मल्लोरी ~~द्वल्लोरी~~ छे सारी, धरमां तो आ

जो वास दरे छे, ठाठ राषि बाणो त्तारी, सु

लापीने पदु छे ध्यारी ॥ अरेरी ॥ १२ ॥

~~द्वल्लोरी~~ आषि पावनमां ~~अरेरी~~ छेरी

तो लागे ध्यारी सारी, आरीरे धीपद बुएरी

रे आमाणी, कुरपी गोतारु तुन्यारी, द

लालनी धने ती धरि त्तारी ॥ अरे ॥ १३ ॥

~~आमा~~ ~~तारु~~ ~~द्वल्लोरी~~ ~~अरेरी~~ ~~अरेरी~~

~~अरेरी~~ ~~अरेरी~~ ~~अरेरी~~ ~~अरेरी~~ ~~अरेरी~~

~~अरेरी~~ ~~अरेरी~~ ~~अरेरी~~ ~~अरेरी~~ ~~अरेरी~~

~~अरेरी~~ ~~अरेरी~~ ~~अरेरी~~ ~~अरेरी~~ ~~अरेरी~~

आवाने लाप्यारी ॥ अरेरी ॥ १४ ॥

अरेरी पठरीपुं हीवेल लावे छे दोड गांसेप

दुआवां, ~~अरेरी~~ ~~अरेरी~~ ~~अरेरी~~ ~~अरेरी~~ ~~अरेरी~~

તાંજા ખારવોળને ગડખડામારી, તંબ્યા  
 ડીનોત્તમપદ્મ છે નારી એરી હોરી ॥ ૧૫ ॥  
 અરે કારી સુધારણ થઈને, મુસલ માની  
 થઈને સોની ને રાખી છે સાફી, ખાંચામાં  
 તો રે છે નસોદા તે ખુબ ફોલાંગે સાઈ  
 નગતમામી કરે ચરચારી ॥ એરી ॥ ૧૬ ॥  
 એટલી નગાપર ખીરાને રે મોહન, કુંડલ  
 ડી લખન્યારી, પરભુ ની ત્રીપાથડી  
 સઈ, એટલી છબી ઘણી પ્યારી, એમાં  
 ફુનીઆ થઈ છે લાખારી ॥ એરી હોરી મ  
 ચારી નગતમામી કરે ચરચારી ॥ ૧૭ ॥

હોળી રત્ન

રાગજાડી.

રસીલા આજ રંગે ની રંગી.

રાગ નમ્મો એવી ઈંચારી ॥ ૧૮ ॥

सा सुनां वयेन सुखी नानु नया,

~~धरु सुखी नानु नया~~ ।

~~धरु सुखी नानु नया~~ ।

अगरी नाना सा खेपे अंगी,

अली नाना सा अंगी नाना सा ॥ २ ॥

सोपी नाना सा खेपे वस्त्र पेटे अंगी,

अली नाना सा अंगी ;

~~अली नाना सा अंगी~~ व्यंजलिया अंगी,

अली नाना सा अंगी ।

पीयुं नाना सा अंगी नाना सा अंगी ॥ ३ ॥

अली नाना सा अंगी अंगी अंगी अंगी,

अली नाना सा अंगी अंगी ।

अली नाना सा अंगी अंगी अंगी,

अली नाना सा अंगी,

अली नाना सा अंगी अंगी अंगी ॥ ४ ॥

रात्र शयन सुतम सुख सोरुं ३.

इधिया इपटे हुंरगी. २.

मीडि पाणी इहो गये सुं पुउणु - २.

दुआते इ शरु हेपुंरु सारंगी. २.

इपी हेपी धाडि छुडि हंगी, नसीला गपप

वीर तणुं यैर न्नाणीने वरीहुं,

अल जेला ~~...~~ कीकीगी.

सासु न्नाणेने जेवा साठ नी साथै.

रस रमी अणु नव रंगी.

येठे मने वीण्य्या हुंरंगी ~~...~~ इ ॥

बिर तणुं यैर अं न्नाणुं पाहाला,

~~...~~ कीकीगी.

इरी विधिने इरी रीवा इरोला.

नकल धार्यो या मरंगी.

दीप - पर नवा ~~...~~ इ ॥



रसीला नु रंग रस्यं न रस्यं नो ,

रसना से न रस्यं रंगी .

रंग उ वृज रस वाध व नयो ,

प्रडग पंनो प्रावीं रंगी .

प्ररो रीपु रंग ये रंगी ॥ रसीला ॥ हा .

वान करो न पुकार करो ह्ये .

छपीला नु भासो छलंगी .

पिन हाड रंगी नु रंगी रीराडो .

रस रं री रसोने रस रंगी .

रीपुदे धा नु रंगी ॥ रसीला ॥ हा

नं रंगी नु रंगी नु रंगी नु रंगी ,

न रंगी नु रंगी नु रंगी .

रीपुदे धा नु रंगी नु रंगी नु रंगी .

रंगी नु रंगी नु रंगी नु रंगी .

रंगी नु रंगी नु रंगी नु रंगी .

रंगी नु रंगी नु रंगी नु रंगी .

એવીશ ઘેરોસ ઊંઠેગી.

પણી હારી ખાલક ~~વધેનેલકું,~~

ઊંઠેગ વસંત અનંગી.

લદેમીરામ વીધવીધરંગી ॥૨૨૧॥

હોળી ૩ ભ

એરી હારી આઈ, ફરફીયા ~~ફરફીયા~~ ઈ

એરી હારી આઈ,

માં ખાપે ન્યાને મુલને પરાણાવી.

સારો જેઈ જમાઈ,

ફુલ ફીણ પાણ ~~ફીણ~~ સાને.

હરખાંજોલકા ખાઈ,

ફરે છે પુરી જાઈ એરી હોરી ॥ ૨૨ ॥

ને રે દીવસની ઘરમાનું આવી

તેને ~~ફરફીયા~~ ~~ફરફીયા~~

પુષ્પ ન નમનો વેરી એ માણનો,

મરને મારા વાધને નાઈ,

દુવામાં નોંધી નાહી, એરી ૩ ૩ ॥

વાહાણુ વાળને નેડીને એ વાણુ,

માફ દુધને મલાઈ,

સાંને નવીન મીઠાઈ નેડીએ,

ફરે ચક્રલા માં નાઈ,

એ વી ખુરી છે લાઈ, એરી ૩ ૩ ॥

ખુરૂં પાયાની ટેવ ધડી છે,

કાઠાડોની જામળ સાફી,

રાખ પીવો એને ખુરૂં ગમે છે.

ખુંડી ફરે છે કેદાઈ.

એને રહી લાભ ન કાંઈ એ સી ૩ ૩ ॥

~~ખુંડી ખુંડી ફરે છે કેદાઈ.~~

મલકનો છે વાઈ, ખુંડી પૈવા પેલા ફરેએ,

तेपर फेटली अजार्थ, सुवाने न द्वाटी तलार्थ

अेशी होरी ॥ ५ ॥

जे लई वीर तुं पत्त लोपी आये ॥

धर मांन लाये पाई, अअरे अअरे ठेपुं डरे  
उपेणे नोणे नोणे नोणे,

सुवाने शीधे न डार्थ, अेशी ॥ ६ ॥

सधला मेळामो सखीची येहे सो,

नाय नार ने अथाई,

चार नीस पुढे नोणे नोणे नोणे,

कायमां लाडी साही,

आज्या जेवा धरु नांमाठी अेशी ७ ॥

पिपाद हा सु मावुं सुजाये,

आल समार गानी,

डोना तुम तुम ने शोम अजार्थ अजार्थ,

तुं नोणे नोणे नोणे नोणे नोणे नोणे साही

अरेरी हरेरी आर्य ए ला

रंगरेण नो माडे गुलाबी डू रो,

~~अरेरी हरेरी आर्य ए ला~~,

अंगरेण छंटी अंगरेण लागे

सुनी घो श्री घो लाई,

धोली पडो सीनी आर्य ए अरेरी ला

~~य हरेरी हरेरी आर्य ए ला~~,

पांसे रसु नथी शं री,

~~अरेरी हरेरी आर्य ए ला~~

विचीले आर्य ए लाई,

~~सु श्री सरेण नो जंही डोई अरेरी प वना~~

~~डोई अरेरी सीपामाए आये,~~

~~अरेरी हरेरी आर्य ए ला~~,

~~अरेरी हरेरी आर्य ए ला~~

(૧૪)

શોભ ભૈ છે નિહુંની નાગઈ, એવી ૧૬૧

બાપુશી રાને રૂપીને ભારી,

રંડોમાં લાખી ઠીણઈ,

એવા વાણીથી નડાનો છે રૂડો,

મરજને ન શાહનાં ભાઈ,

ને લા-ગે ~~જાણી~~ સાહી ॥ એવી ૧૬૨ ॥

ને નરમુરા ઠીણી ~~જાણી~~ ત્યા,

લાગે ત્યાં ફોની નાગઈ,

બંગળ ~~જાણી~~ની સીખે દેયછે.

એવી ન રૂડ સો નાગઈ,

નહી રસો થી બળ પાઈ,

એવી ફોની ભાઈ ॥ ૧૬૩ ॥

— રોળી ૪ થાં. —

કોરા કુમ કુમ નિ ~~જાણી~~ પેળે પેળે બંધણ

કુમ કુમ ~~જાણી~~ નાગઈ, વાલ્યાણ પે મલગી સાદ

